



સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 ઉપાયો સાવધાનીપૂર્વક અને ધીમે ધીમે સરળ બનાવવા પ્રોવિન્સના પગલાઓને અનુરૂપ કાર્યક્રમો અને સેવાઓ અદ્યતન કરવાની તૈયારીઓ કરી રહ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 25, 2022) – ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની ગયા અઠવાડિયાની ઘોષણા પછી, સીટી ઓફ બ્રેમ્પટન જાન્યુઆરી 31, 2022 થી શરૂ કરીને કાર્યક્રમો અને સેવાઓ અદ્યતન કરવાની અને કેટલીક સગવડો રિઓપન કરવાની તૈયારી કરી રહ્યું છે.

પ્રોવિન્સના જાન્યુઆરી 31 થી અમલી બનતા આરોગ્ય અને સુરક્ષા ઉપાયો

સોમવાર, જાન્યુઆરી 31 નાં રોજ મળસ્કે 12:01 વાગ્યાથી, નીચેના ઉપાયો અમલી બનશે:

- સામાજિક હળવા-મળવાની મર્યાદા વધારીને ઇનડોરમાં 10 લોકો અને આઉટડોરમાં 25 લોકો સુધી કરવામાં આવી.
- ઇનડોર જાહેર સ્થળોમાં ક્ષમતા સીમાઓ વધારવી અથવા 50 ટકા સુધી જાળવવી, જેમાં નીચેના સ્થળો સામેલ છે પણ એટલે સુધી સીમિત રહેતું નથી:
 - રેસ્ટોરન્ટ્સ, બાર્સ, અને ડાન્સ સગવડો વગરની અન્ય ખાદ્ય પદાર્થો કે પીણાં વેચતા ધંધાઓ;
 - રિટેઈલર્સ (કરિયાણાંની દુકાનો અને ફાર્મસી સહિત);
 - શોપિંગ મોલ્સ;
 - રમતો અને જીમ સહિતની મનોરંજનલક્ષી તંદુરસ્તી સગવડો માટેના દર્શક-રહિત વિસ્તારો
 - સિનેમા;
 - મીટિંગ અને પ્રાસંગિક આયોજનો;
 - વોટર પાર્ક્સ સહિતની, મનોરંજનલક્ષી સગવડો અને એમ્યુઝમેન્ટ પાર્ક્સ;
 - મ્યુઝિયમ્સ, ગેલેરીસ, એકવેરિયમ્સ, ઝૂ અને સરખા આકર્ષણો;
 - કેસિનો, બિંગો હોલ્સ અને અન્ય ગેમ્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ; અને
 - ધાર્મિક સેવાઓ, ધાર્મિક વિધિઓ, અથવા સમારોહ.
- સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ, કન્સર્ટ સ્થળો, થિયેટર્સ જેવી સગવડોના દર્શક વિસ્તારોની 50 ટકા બેઠક ક્ષમતા અથવા 500 લોકોને, બેમાંથી જે પણ ઓછી હોય તેને મંજૂરી આપવી.

હયાત સ્થળોએ રસીકરણ અને અન્ય જરૂરિયાતોનો વધારાનો પુરાવો લાગુ થવાનું ચાલુ રહેશે.

શહેરી સેવાઓ, કાર્યક્રમો અને સગવડો

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો ફેબ્રુઆરી 21 થી, વોક-ઇન (ગમે ત્યારે ચાલ્યા આવવાની) સર્વિસીસ માટે રિઓપન થશે. ત્યાં સુધી, સેવાઓ માત્ર એપોઈન્ટમેન્ટથી ઉપલબ્ધ છે. એક એપોઈન્ટમેન્ટ બુક કરાવવા, વેબસાઈટ જુઓ www.brampton.ca/skiptheline.

સગવડમાં બેઠક જગ્યાઓ અને રેન્ટલ્સને સંબંધિત વધુ વિગતો આગામી અઠવાડિયાઓમાં પૂરી પાડવામાં આવશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ આગળ નોટિસ આપવામાં આવે નહિ ત્યાં સુધી ઘટાડેલા સેવા સ્તરોએ સંચાલન કરી રહ્યું છે. પસંદગીના સંચાલનના ટર્મિનલ ક્લાકો પણ અનુકૂળ કરવામાં આવી શકે.

સૌથી અદ્યતન રૂટ્સ સમયપત્રક અને સંચાલનના ક્લાકોને લગતી માહિતી માટે, ગ્રાહકોને બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર કોલ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સેવાને લગતી અદ્યતન માહિતી નિયમિત મેળવવા માટે વેબસાઈટ www.bramptontransit.com જુઓ અથવા [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને Twitter પર અનુસરો.

પ્રવાસ કરતી વખતે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરતા લોકોને બસમાં અને ટર્મિનલ્સ પર ચુસ્ત-બંધ બેસતો મારક પહેરવાનું, અને અવરજવર કરતી વખતે કંઈક ખાવા કે પીવા મારક્સ નીચો કરવાનું ટાળવાનું યાદ અપાવવામાં આવે છે સિવાય કે તબીબી કટોકટી હોય. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય દર 48 કલાકે તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

મનોરંજન

ઈનડોર મનોરંજનલક્ષી સવલતો

રિક્રિએશન સેન્ટર્સ નિર્ધારિત નોંધાયેલા અને ડ્રોપ-ઈન કાર્યક્રમો માટે સોમવાર, જાન્યુઆરી 31 નાં રોજ રિઓપન થશે. પ્રોવિન્સના નિયમનો અનુસાર, રિક્રિએશન સેન્ટર્સમાં ક્ષમતા સીમાઓ પચાસ ટકા સુધી ઘટાડવામાં આવશે. રિક્રિએશન સેન્ટર્સની મુલાકાતો માટે પહેલેથી નોંધણી જરૂરી નથી, જોકે, બધી સેવાઓ પહેલો તે પહેલો ધોરણે અપાતી હોવાને લીધે મુલાકાતીઓ પોતાની મુલાકાત પહેલાં પોતાની સર્વિસ અગાઉથી ઓનલાઈન ખરીદે તેવી ભલામણ કરવામાં આવે છે. બુધવાર, જાન્યુઆરી 26 નાં રોજ સવારે 10 વાગ્યાથી શરૂ કરીને ઉપલબ્ધ કાર્યક્રમો વેબસાઈટ www.brampton.ca/registerforprograms પર ઓનલાઈન જોઈ શકાય છે.

શિયાળુ નોંધાયેલા સત્રીય કાર્યક્રમો

શિયાળુ નોંધાયેલુ સત્ર જાન્યુઆરી 31 થી શરૂ કરીને એક ટૂંકા સત્ર માટે ફરી શરૂ થશે. કાર્યક્રમ પૂરો થવાની તારીખો અનુકૂળ કરવામાં આવશે નહીં. શિયાળુ કાર્યક્રમો માટે અગાઉ નોંધણી કરાવનારા સહભાગીઓ જેઓએ ઘટેલા સત્ર સમયગાળાની ભરપાઈ કરવા પોતાના ક્લાયન્ટ એકાઉન્ટમાં પ્રો-રેટા (પ્રમાણાનુસાર) ક્રેડિટ મેળવી હોય.

સભ્યપદો

સભ્યપદનું વેચાણ બુધવાર, જાન્યુઆરી 26 નાં રોજ સવારે 10 વાગ્યે ફરી શરૂ થશે. ઉપલબ્ધ સભ્યપદ વિકલ્પો વેબસાઈટ www.brampton.ca/memberships પર ઓનલાઈન જોઈ શકાય છે.

રસીકરણના પુરાવાની જરૂરિયાતો



સીટી ઓફ બ્રેમ્પટન રિક્લિએશન સેન્ટર્સમાં પ્રવેશતા 12 વર્ષ અને વધારે ઉંમરના બધાં મુલાકાતીઓએ રસીકરણ સ્થિતિનો પુરાવો દેખાડવો અનિવાર્ય છે. આ રિક્લિએશન સેન્ટર્સમાં બધાં સહભાગીઓ અને પ્રેક્ષકોને લાગુ પડે છે, જેમાં જુવાનિયાઓ, કોચીસ, ઈન્સ્ટ્રુક્ટર્સ, સંભાળ રાખનારાઓ, સ્વયંસેવકો અને રમત અધિકારીઓ સામેલ છે.

વર્ષ 2022 માં 12 વર્ષના થતા (2010 માં જન્મેલા) બાળકોને તેઓની જન્મ તારીખથી 12 અઠવાડિયાનો ગ્રેસ પીરિયડ પૂરો પાડવામાં આવશે, જે દરમિયાન તેઓએ ઈનડોર સ્પોર્ટ્સ અને મનોરંજનલક્ષી સગવડોમાં રસીકરણનો પુરાવો દેખાડવાની જરૂર પડશે નહીં. આનાથી બાળકોને રસીકરણ કરાવવા જરૂરી સમય મળી રહેશે અને રસીકરણના પુરાવાની જરૂરિયાતોને પહોંચી વળવાની છૂટ મળશે. 12 અઠવાડિયાનો ગ્રેસ પીરિયડ પૂરો થયા પછી, તેઓએ રસીકરણનો પુરાવો દેખાડવો અનિવાર્ય બનશે.

રસીકરણ પદ્ધતિનો સ્વીકાર્ય પુરાવો

રિક્લિએશન સેન્ટર્સમાં મુલાકાતીઓએ QR કોડ ધરાવતા એન્ડાન્સડ (વધારે સારા) રસી પ્રમાણપત્રનો ઉપયોગ કરવાની અને ઓન્ટેરિયો એપની ચકાસણી કરાવવાની જરૂર પડશે. QR કોડ ડિજિટલી અથવા કાગળ નકલ છાપીને ઉપયોગમાં લઈ શકાય છે. એક્લદોકલ વ્યક્તિઓ પોતાનું QR કોડ ધરાવતું વધારે સારું પ્રમાણપત્ર [અહીં](#)થી ડાઉનલોડ કરી શકે છે. સંપૂર્ણ રસીકરણના પુરાવાના વિકલ્પ તરીકે નકારાત્મક COVID-19 પરીક્ષણનો પુરાવો સ્વીકારવામાં આવશે નહીં. રિક્લિએશન સેન્ટર્સમાં પ્રવેશવા લેખિત તબીબી મુક્તિઓ હવે બિલકુલ સ્વીકારવામાં આવતી નથી.

ઓનલાઈન સ્કીનિંગ

બધાં મુલાકાતીઓ પાસે સીટી ઓફ બ્રેમ્પટન રિક્લિએશન સેન્ટર્સમાં આગમન પહેલાં ઓનલાઈન સ્કીનિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ ફોર્મ ભરવાનો વિકલ્પ રહેશે. ઓનલાઈન સ્કીનિંગ ટૂલમાં પહોંચવા [અહીં](#) મુલાકાત લો. મુલાકાતીઓ પોતાની મુલાકાત પહેલાં સ્માર્ટફોન/કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને પ્રી-સ્કીનિંગ પ્રશ્નો ઓનલાઈન ભરીને સમય બચાવી શકે છે. નિર્ધારિત સ્કીનિંગ વિસ્તાર/પ્રવેશદ્વાર પર આગમન સમયે, બધાં મુલાકાતીઓએ ફોનથી સ્કીનિંગ કન્ફર્મેશન (લીલી નિશાની ચિહ્નિત) અચૂક દેખાડવું રહ્યું. ઓનલાઈન પ્રી-સ્કીનિંગ ન ભરવા ઈચ્છતા મુલાકાતીઓ માટે સ્થળ પર કાગળ-આધારિત કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપલબ્ધ કરાવાનું ચાલુ રહેશે.

આઉટડોર મનોરંજનલક્ષી સવલતો

આઉટડોર સ્કેટિંગ અને માઉન્ટ ચિંગકુસી સહિતના, આઉટડોર કાર્યક્રમો અને સવલતો ઉપલબ્ધ થવાનું ચાલુ રહે છે. આઉટડોર કાર્યક્રમો અને સેવાઓ સંબંધમાં અદ્યતન માહિતી વેબસાઈટ www.brampton.ca/winterwonderland પર ઉપલબ્ધ છે. સ્કેટિંગ રિંક્સનું સંચાલન વહેલો તે પહેલો ધોરણે, હવામાન અને બરફની પરિસ્થિતિઓ અનુકૂળ રહે તો ચાલુ રહેશે. મુલાકાતીઓને પોતાની મુલાકાત પહેલાં આઉટડોર સ્કેટિંગ માર્ગરેખાઓ અને આઉટડોર રિંગ સંચાલનલક્ષી સ્થિતિની અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/outdoorskating જોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ધી રોજ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ સગવડો

સીટી ઓફ બ્રેમ્પટનની બધી ઈનડોર પરફોર્મિંગ આર્ટ્સ સગવડો રિહર્સલ્સ અને રેકોર્ડ કરેલા પરફોર્મન્સીસ માટે ઉપલબ્ધ રહે છે. લાગુ COVID-19 પ્રતિબંધો સાથે, રૂબરૂમાં દર્શકો સાથેના પરફોર્મન્સીસ માર્ચ 2022 માં ફરી શરૂ થશે.

ફેમિલી ડે માટે ગાર્ડન સ્ક્વેરમાં આઉટડોર કાર્યક્રમો ફેબ્રુઆરી 21, 2022 નાં રોજ યોજાશે.



બધાં ટિકિટ ધારકો ક્રેડિટ/ચેક, એકાઉન્ટ ક્રેડિટ, અથવા ડોનેશન માટેનું રિફંડ boxoffice@brampton.ca ને ઈમેઇલ મોકલીને મેળવી શકે છે.

વધારાની વિગતો અહીં ઉપલબ્ધ છે, www.FairDealForBrampton.ca.

LBP અને સીરિલ ક્લાર્ક થિયેટર્સ લાગુ COVID-19 પ્રતિબંધો સાથે માર્ચ 2022 માં રિઓપન થશે.

બ્રેમ્પટન લાઇબ્રેરી

બ્રેમ્પટન લાઇબ્રેરીની બધી શાખાઓ બ્રાંચમાં સેવાઓ માટે દરરોજ ખુલ્લી છે, માઉન્ટ પ્લીઝન્ટ વિલેજ સિવાય, જે માત્ર દરરોજ કર્બસાઇડ પિકઅપ સર્વિસ આપે છે. રહેવાસીઓ પ્રોફેસર્સ લેક, લોફર્સ લેક અને ચિંગકુસી પાર્ક્સમાં આઉટડોર સ્ટોરી વોક્સનો આનંદ માણી શકે છે, જે ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે. ચિંગકુસી બ્રાંચ લાઇબ્રેરી શિયાળુ પ્રવૃત્તિની કિટ્સનો જથ્થો ઉપલબ્ધ રહે ત્યાં સુધી વહેલો તે પહેલો ધોરણે મફતમાં ઉધાર આપી રહી છે. વિગતો માટે વેબસાઇટ જુઓ, www.bramptonlibrary.ca.

COVID-19 રસીકરણ

તમને પોતાને અને અન્ય લોકોને સંરક્ષણ આપવા માટે રસીઓ શ્રેષ્ઠ રીત છે. પાંચ વર્ષ અને ઉપરની કોઈપણ વ્યક્તિ માટે હવે ઓન્ટેરિયોની વેક્સિન બુકિંગ સિસ્ટમ મારફતે અથવા 1.833.943.3900 નંબર પર કૉલ કરીને એપોઇન્ટમેન્ટ્સ બુક કરાવી શકાય છે.

18 વર્ષ અને ઉપરની વ્યક્તિઓ માટે હવે પોતાની COVID-19 બુસ્ટર એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકાય છે જો તેઓના છેલ્લાં ડોઝથી ઓછામાં ઓછાં ત્રણ મહિના પસાર થયા હોય. એપોઇન્ટમેન્ટનું બુકિંગ કરાવવા વેબસાઇટ જુઓ, <https://covid-19.ontario.ca/covid-19-vaccines-ontario>.

રસીકરણ પર સૌથી અદ્યતન માહિતી માટે, [પ્રોવિન્સનું વેક્સિન પોર્ટલ](http://provincenun.vaccineportel.com) જુઓ.

માસ્કસ

રહેવાસીઓને યાદ અપાવવામાં આવે છે કે સીટીએ પોતાનો બ્રેમ્પટન COVID-19 મેન્ટેરી ફેસ માસ્ક બાય-લો એપ્રિલ 1, 2022 સુધી લંબાવ્યો છે.

COVID-19 મેન્ટેરી ફેસ માસ્ક બાય-લો હેઠળ, બ્રેમ્પટનમાં બધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ માસ્કસ પહેરવા અનિવાર્ય છે. ફેસ ક્વરિંગ્સ તરીકે સ્કાર્ફ, બંદાનાસ, નેક ગેઇટર્સ કે નેક વોર્મર્સ અને એક્ઝેલેશન વાલ્સ ધરાવતા માસ્કસ સ્વીકાર્ય નથી. તેમજ બાય-લો હેઠળ, માસ્કસ માત્ર ખોરાક કે પીણું લેવા માટે જ કાઢી શકાય છે જો વ્યક્તિ તે હેતુસર એક નિર્ધારિત જગ્યાએ બેસેલ હોય.

રહેવાસીઓ મહામારીનો ફેલાવો રોકવામાં મદદ મળે તેથી પોતાનો ભાગ ભજવવાનું, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું, સારા સ્વચ્છતાશાસ્ત્રનો મહાવરો કરવાનું અને માસ્કસ પહેરવાનું ચાલુ રાખે તે માટે સીટી તેઓનો આભાર માને છે.

-30-

मिडिया संपर्क:

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मीडिया अँड कम्युनिटी एंगेजमेन्ट (Coordinator, Media & Community Engagement)

स्ट्रेटेजिक कम्युनिकेशन (Strategic Communication)

सीटी ऑफ़ ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca